

PART PLAN SHOWING
R.S. NO.: - 135
MOJE:- NAROL
TALUKA:- MANINAGAR
DISTRICT:- AHMEDABAD



1 c.m. = 40 mt.

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt. of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

LEGEND

- Residential Zone I-R1
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road
- Waterbody



This part plan is certified for the R.S. NO. : - 135

- NOTE :-
- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
 - (2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.: - RP2019/410/339./10/04/19
Amount Recieved Rs. 1000/-
Receipt No..... 733/106 Dtd..... 10/04/2019.

TRUE COPY

Prep. By: *[Signature]*
11/04/19

Chd. By: *[Signature]*
11/04/2019

H. D' man: *[Signature]*
11/04/2019

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

PART PLAN OF PRELIMINARY TOWN PLANNING SCHEME NO:60(NAROL-SOUTH-2)

Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat

Notification NO:- GH/ V/ 53 of 2019/ TPS-112014-478-L; Dt.08-03-2019.

FINAL PLOT NO: 48/1



SCALE: 1c.m. = 30 Mts.



This part plan is certified for the F.P NO: 48/1

Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. P-20190410/461 તા. 10/04/19 થી
નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. ૪૩૩/૧૦૭ તા. 10/04/19
રૂા. 1000/- વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

LEGEND

- F.P. BOUNDARY
- ROAD
- T.P.S. BOUNDARY

TRUE COPY

Prep. By:

Chd. By:

H. D' man:

TOWN PLANNING INSPECTOR
TOWN PLANNING DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧, ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- RZ20190410/340

અરજી તા.:-૧૦/૦૪/૨૦૧૯.

પહોંચ નં.:-૭૩૩/૧૦૫, તા.:-૧૦/૦૪/૨૦૧૯

અરજદારશ્રી, રાજેશભાઈ જી. દેસાઈ,

નવરંગપુરા, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GHV/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

મોજે/ રેવન્યુગામ :- નારોલ

રે.સર્વે નંબર:- :- ૧૩૫

રી.ડી.પી. શીટ નં. :- ૧૨૦+૧૨૯

ની જમીનની દક્ષિણ દિશાએ પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ૧૮.૦૦મી.નો રસ્તો પસાર થાય છે, તેની અસર થાય છે, તેમજ સદરહુ રસ્તામાંથી ઉત્તર દિશા તરફ ૨૪.૦મી રોડની તેમજ રોડ ગોળાઈ ની અસર થાય છે, બાકી રહેતો "રહેણાંક ઝોન-૧ (એક) R1"માં આવે છે.

નોંધ:

૧. સદરહુ જમીન પ્રિલિમિનરી મંજૂર ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.:- ૬૦ (નારોલ સાઉથ-૨) ના વિસ્તારમાં આવે છે.

૨. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

ખરી નકલ

તારીખ ૧૧/૦૪/૨૦૧૯.

જી. ફાફ્ટસમેન

હેડ ફાફ્ટસમેન

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ.